



# ગુજરાત યુનિવર્સિટી

નવરંગપુરા, અમદાવાદ 380009

## નવી કોલેજ શરૂ કરવા અંગેની જાહેરાત

ગુજરાત યુનિવર્સિટી એક્ટ, 1949ની ધારા-33 અન્વયે યુનિવર્સિટી વિસ્તારમાં શૈક્ષણિક વર્ષ 2015-16થી આર્ટ્સ, કોમર્સ તથા સાયન્સ વિદ્યાશાખાઓમાં નવી કોલેજો શરૂ કરવા ઈચ્છતા રજિસ્ટર્ડ ટ્રસ્ટ, મંડળ કે સોસાયટી પાસેથી તા. 16-05-2015 સુધીમાં કામકાજના દિવસોમાં કાર્યાલયના કામકાજના સમય દરમિયાન અચૂક મળી રહે તે મુજબ નિયત અરજીપત્રકોમાં અરજીઓ મંગાવવામાં આવે છે. કોલેજ શરૂ કરવા અંગેના નિયમોની માહિતી, જોડાણ અંગેનું અરજી પત્રક તથા એફિડેવિટની નકલ [www.gujaratuniversity.org.in](http://www.gujaratuniversity.org.in) ઉપરથી મેળવવાના રહેશે. નવા જોડાણની ફી રૂ. 2,00,000/- + અરજી ફી રૂ. 5,000/- + સ્થાનિક તપાસ સમિતિ ફી રૂ. 25,000/- મળી કુલ રૂ. 2,30,000/- (નોન-રીફંડેબલ)નો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ કુલસચિવશ્રી, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના નામનો જોડાણ અરજી તમામ પ્રમાણિત દસ્તાવેજો તથા એફિડેવિટ (બે નકલમાં સી.ડી. સહિત) સાથે મોકલવાનો રહેશે.

1. યુ.જી.સી.ના નિયમ અનુસાર જે રજિસ્ટર્ડ ટ્રસ્ટ, મંડળ કે સોસાયટી પાસે અમદાવાદ શહેરમાં 2 એકર અથવા અન્ય જગ્યાએ 5 એકર જમીન ટ્રસ્ટ, મંડળ કે સોસાયટીની માલિકીની હોય અને રેવન્યુ રેકોર્ડમાં નોંધ થયેલ હોય તથા ટાઈટલ ક્લીયર હોય તેમણે જ નવી કોલેજ માટે અરજી કરવી.
2. કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય તેની અંદર કોઈપણ ટ્રસ્ટ, મંડળ કે સોસાયટી નવી કોલેજ શરૂ કરી શકશે નહીં.
3. નિયત તારીખ બાદમાં યુનિવર્સિટીને મળેલ જોડાણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. તેમજ ત્યારબાદ આવેલ અરજીઓ રદ થવાને પાત્ર ઠરશે.
4. અધુરી વિગતો સાથેની જોડાણ અરજીઓ રદ થવાને પાત્ર ઠરશે.
5. શિક્ષણ વિભાગના પત્રાંક: સજય/2006/1602/ખ.1, તા. 11-08-2014થી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસક્ષેત્રની પ્રવૃત્તિઓમાં રુચિ ઉત્પન્ન થાય તે માટે નવી જોડાણ મેળવતી કોલેજોએ SCOPE, NSS, NCC તથા અન્ય કોઈ અભ્યાસક્ષેત્રે સંબંધિત પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તે રીતે પોતાની રીતે આ અંગેની વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.
6. જે કોઈ ટ્રસ્ટ, મંડળ કે સોસાયટી દ્વારા નવા જોડાણ માટે જે વિદ્યાશાખાની જોડાણ અરજી કરી કરેલ હશે તે વિદ્યાશાખાને પાછળથી અન્ય વિદ્યાશાખામાં તબદીલ કરવામાં આવશે નહીં.
7. તા. 26-03-2015ની નીડ કમિટી દ્વારા કરવામાં આવેલ ઠરાવોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. જે કોલેજોને માન્યતા આપવામાં આવે તે કોલેજોએ યુ.જી.સી. તથા ગુજરાત યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવેલ ડેવલપમેન્ટ ફંડ, ડીપોઝીટ, ફી વગેરે ભરવાના રહેશે તથા નિયમોનું પાલન કરવાનું રહેશે.
8. University Grants Commission [Affiliation of Colleges by Universities] Regulations, 2009 તથા University Grants Commission [Affiliation of Colleges by Universities] (1st Amendments) Regulations, 2012 તથા ગુજરાત યુનિવર્સિટીના વખતોવખતના નિયમોનું પાલન કરવાનું રહેશે.
9. એક જ કેમ્પસમાં એક કે તેથી વધુ ટેકનિકલ/પ્રોફેશનલ કે અન્ય કોલેજ ચાલતી હોય તો આવી કોલેજો માટે નિયત કરવામાં આવેલ જમીનને બાદ કરીને યુ.જી.સી.ની જોગવાઈઓ મુજબની સ્વતંત્ર જમીન તથા બિલ્ડીંગ હોવા જોઈશે.
10. એક સંસ્થાની મંજૂરી મળેલ હોય તો તે સંસ્થાને તે જ જગ્યાએ તેવી જ બીજી કોલેજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
11. ગ્રામ્ય વિસ્તારમાં માત્ર બહેનો માટે નવી કોલેજ શરૂ કરવા માંગતી સંસ્થાઓને તા. 26-03-2015ની નીડ કમિટીના ઠરાવ નં. 5, 6(a) તથા 6(b)માં દર્શાવેલ ફીના ધારાધોરણોમાં 25% છૂટછાટ આપવામાં આવશે.

જાહેરાત ક્રમાંક: એકેડેમિક/273/2015

તારીખ: 17-04-2015

કુલસચિવ



# ગુજરાત યુનિવર્સિટી

નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯

## નવી કોલેજ શરૂ કરવા અંગેની જાહેરાત

ગુજરાત યુનિવર્સિટી એક્ટ, ૧૯૪૯ની ધારા-૩૩ અન્વયે નીડ કમિટી દ્વારા કરવામાં આવેલ ઠરાવોને આધારે યુનિવર્સિટી વિસ્તારમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬થી આર્ટ્સ, કોમર્સ તથા સાયન્સ વિદ્યાશાખાઓમાં નવી કોલેજો શરૂ કરવા ઈચ્છતા રજિસ્ટર્ડ ટ્રસ્ટ, મંડળ કે સોસાયટી પાસેથી તા. ૧૬-૦૫-૨૦૧૫ સુધીમાં કામકાજના દિવસોમાં કાર્યાલયના કામકાજના સમય દરમિયાન અચૂક મળી રહે તે મુજબ નિયત અરજીપત્રકોમાં અરજીઓ મંગાવવામાં આવે છે. આ અંગેની વિસ્તૃત જાહેરાત, નિયમોની માહિતી, જોડાણ અંગેનું અરજી પત્રક તથા એકિડેવિટની નકલ [www.gujaratuniversity.org.in](http://www.gujaratuniversity.org.in) ઉપરથી મેળવવાના રહેશે. નિયત તારીખ બાદમાં યુનિવર્સિટીને મળેલ જોડાણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. તેમજ ત્યારબાદ આવેલ અરજીઓ રદ થવાને પાત્ર ઠરશે.

જાહેરાત ક્રમાંક: એકેડેમિક/૨૭૩/૨૦૧૫

તારીખ: ૧૭-૦૪-૨૦૧૫

કુલસચિવ